GUICHEM DISTILLERS INDIA LIMITED

DATE: May 18, 2024

To **BSE** Limited, P. J. Towers Dalal Street, Mumbai - 400 001

> SUB.: Newspaper Advertisement for completion of dispatch of Notice of Extra **Ordinary General Meeting** BSE Scrip Code: 506640

Dear Sir, 🛝

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find attached herewith copies of newspaper advertisement regarding completion of dispatch of Notice of Extra Ordinary General Meeting published on May 18, 2024 in the Financial Express (Gujarati and English language).

AHMEDABAD

This is for your intimation and record.

Thanking You, Yours faithfully,

For, GUJCHEM DISTILLERS INDIA LIMITED

WHOLE-TIME DIRECTOR DIN: 07889459

.egistered Office: Survey No. 146, Plot No. 314, 307, 3rd Floor, Ashirwad Paras-1, S. G. Highway, Makarba, Ahmedabad-380051, Gujarat E-mail: gujchemdistillers@gmail.com Phone: +91 9998860235 CIN: L74110GJ1939PLC002480

Website: www.gujchemdistillers.in

BAJAJ HOUSING FINANCE LIMITED

Corporate office: Cerebrum IT Park B2 Building 5th floor, Kalyani Nagar, Pune, Maharashtra 411014 Branch Offices: 4th floor, RK Plaza, 409-410, R.K. Plaza, Diwalipura, Vadodara-390007. Gujarat Branch Offices: 3rd floor, Gondal Rd, Udhyog Nagar Colony, Bhakti Nagar, Rajkot, Gujarat 360002

Demand Notice Under Section 13 (2) of Securitization and Reconstruction of Financial

Assets and Enforcement of Security Interest Act, 2002.

Undersigned being the Authorized officer of M/s Bajaj Housing Finance Limited, hereby gives the following notice to the Borrower(s)/Co-Borrower(s) who have failed to discharge their liability i.e. defaulted in the repayment of principal as well as the interest and other charges accrued there-on for Home loan(s)/Loan(s) against Property advanced to them by Baiai Housing Finance Limited, and as a consequence the loan(s) have become Non Performing Assets. Accordingly notices were issued to them under Section 13 (2) of Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and rules there-to, on their last known addresses, however the same have been returned un-served/undelivered, as such the Borrower(s)/Co-Borrower(s) are hereby intimated/informed by way of this publication notice to clear their outstanding dues under the loan facilities availed by them from time to time.

Loan Account No./Name of the Borrower(s)/ Co-Borrower(s)/Guarantor(s) & Addresses	Address of the Secured/ Mortgaged Immovable Asset/ Property to be enforced	Demand Notice Date & Amount
Branch: VADODARA LAN No. H413HHL0218807 and H413HLT0221711 1. AJITKUMAR SINGH (Borrower) 2. RUCHI SINGH (Co-Borrower) At A 403, Shreenath Villa, Opp Vaikunth Wod Road, Vadodara – 390019	All that piece and parcel of the Non-agricultural Property described as: FLAT NO A-403, 4TH FLOOR, TOWER A, SHREENATH VILLA, NR VAIKUNTH CROSS ROAD, OPP AMBE SCHOOL, WAGHODIA ROAD, VADODARA, GUJARAT – 390019. East: FLAT NO A 402, West: 18 MTR ROAD, North: FLAT NO A 404, South: TOWER B	11th May 2024 & Rs. 25,55,204/- (Rupees Twenty Five Lac Fifty Five Thousand Two Hundred Four Only)
Branch: RAJKOT LAN No. H416HLD1081635 and H416HLT1098716 1. JAYDEEP JAYANTIBHAI DHAMELIYA (Borrower), 2. DIPTIBEN JAYDEEPBHAI DHAMELIYA (Co-Borrower) At Flat No 501, Fifth Floor Bhagvati Appartment, Manahar Plot, Street No 10, Rajkot, Gujarat-360002	All that piece and parcel of the Non-agricultural Property described as: Flat No. 501, Fifth Floor, Bhagwati Apartment, Plot No. 48 From Rajkot Muncipal Corporation's Bhaktinagar Scheme, Sheet No. 180, City Survey No. 1990, Ward No. 6, Rajkot, Gujarat — 360002. East: Open Area After Some Margin, West: Others Property, North: Flat No 502, South: Road After Some Margin	11th May 2024 & Rs. 26,37,144/- (Rupees Twenty Six Lac Thirty Seven Thousand One Hundred Forty Four Only)
This step is being taken for substituted service of noti-	ce. The above Borrowers and/or Co-Borrowers Guarantors) are advised	to make the payments of

outstanding along with future interest within 60 days from the date of publication of this notice failing which (without prejudice to any other right remedy available with Bajaj Housing Finance Limited) further steps for taking possession of the Secured Assets/ mortgaged property will be initiated as per the provisions of Sec. 13(4) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. The parties named above are also advised not to allenate, create third party interest in the above mentioned properties. On which Bajaj Housing Finance Limited has the charge.

Place: Vadodara / Raikot Date: 18 May 2024

Sd/- Authorized Officer, Bajaj Housing Finance Limited

BAJAJ FINANCE LIMITED

Registered Office: Off Pune-Ahmednagar Road, Viman Nagar, Pune 411014. Branch: 1st to 4th Floor Touchstone Realty Opp. Baroda People Co-Operative Housing Society Besides Spencer S Mall Genda Circle Vadodara 390007

> Demand Notice Under Section 13 (2) of Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002.

Undersigned being the Authorized officer of M/s Bajaj Finance Limited, hereby gives the following notice to the Borrower(s)/ Co-Borrower(s) who have failed to discharge their liability i.e. defaulted in the repayment of principal as well as the interest and other charges accrued there-on for Home loan(s)/Loan(s) against Property advanced to them by Bajaj Finance Limited and as a consequence the Ioan(s) have become Non Performing Assets (N.P.A's). . Accordingly, notices were issued to them under Section 13 (2) of Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and rules there-to, on their last known addresses, however the same have been returned un-served/undelivered, as such the Borrower(s)/Co-Borrower(s) are hereby intimated/informed by way of this publication notice to clear their outstanding dues under the loan facilities availed by them from time to time.

Loan Account No./Name of the Borrower(s)/ Co-Borrower(s)/Guarantor(s) & Addresses	Address of the Secured/ Mortgaged Immovable Asset/ Property to be enforced	Demand Notice Date and Amount
Branch: Vadodara, LAN: P413PFB4026452 Borrower's /Co-Borrower's 1. Payal Jayantibhai Patel D/o Patel Jayantibhai, R/o Plot No.3 Plot No. 4 Nishad Residency 2 Tower A 102 Vadodara Gujarat 390023. Also At, R/o 36, Madhur Milan Society High Tension Road Subhanpura Vadodara 390023 Gujarat Also At, R S No. 7 Paiki Tps No. 2 Fp No. 301 Flat No. A-102 1st Floor Tower A Nishad Residency 2 Opp. Vallabh Complex Nr. Aishwarya Complex B/h Inox Cinema At Jetalpur Tal & Dist. Vadodara 390007. 2. Inbox Infotech Private Limited Thr. Its Director Payal Patel R/o. 4th Floor 404 405 Sears Towers Gotri Sewasi Main Road Vadodara Gujarat 391001. 3. Sumit Sejwal S/o Ravinder Sejwal, R/o. 55 A Adhchini Village New Delhi Aurovindo Marg Delhi 110017	Residency 2 Opp. Vallabh Complex Nr. Aishwarya Complex B/h Inox Cinema At Jetalpur Tal & Dist. Vadodara 390007 along with	(Rupees Fifty Lakhs Fifty One Thousand Six Hundred Nineteen

payments of outstanding along with future interest within 60 days from the date of publication of this notice failing which (without prejudice to any other right remedy available with Bajaj Finance Limited) further steps for taking possession of the Secured Assets. Mortgaged property will be initiated as per the provisions of Sec. 13(4) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. The parties named above are also advised not to alienate, create third party interest in the above mentioned properties. On which Bajaj Finance Limited has the charge.

Place: Vadodara, Date: 18.05.2024

For M/s Bajaj Finance Limited **Authorized Officer**

POSSESSION NOTICE

nereas, the authorized officer of **Jana Small Finance Bank Limited** (Formerly known as Janalakshmi Financial Services Limited under the Securitization And Reconstruction of Financial Assets And Enforcement Of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 issued demand notices to the borrower(s)/ Co-borrowers(s) calling upon the borrowers to repay the amount mentioned against the respective names together with interest thereon at the applicable rates as mentioned in the said notices within 60 days from the receipt of the said notices, along with future interest as applicable incidental expenses, costs, charges etc. incurred till the date of payment and/or realisation.

Sr. No.	I nan No	Borrower/ Co-Borrower/ Guarantor/ Mortgagor	13(2) Notice Date/ Outstanding Due (in Rs.) as on	Date/ Time & Type of Possession			
1	33369610000361	1) Shah Jaimil Mukeshkumar, 2) Shah Rajalben	One Lakhs Fifty Thousands One Hundred and Twenty Nine Only) as of 19/12/2023	Date: 15/05/2024 Time: 12:05 PM Symbolic Possession			
1		ption of Secured Asset: All that piece and parcel of Freehold immovable Property being Plot No.E/3, having Surep Plot					
1	Area admeasuring 600 Sq.yads., i.e. 501.67 Sq.mtrs., togetherwith construction erected to erected standung thereon in the						
1			Situated and Lying on Non-agricultural land				
1	Paiki 6 of Mouje Za	amp, Taluka Sanand in the District Ahme	edabad and Resgistion Sub District Sanand wit	thin the State of Gujarat.			
1	Boundaries by: E	ast: Sub Plot No.E/2. West: Road. No.	orth: Sub Plot No.E/2. South: Sub Plot No.E/4				

25/01/2024, Rs.31,42,354.00 (Rupees Thirty 1) Shah Manankumar, 33369610000447 One Lakhs Forty Two Thousands Three Time: 12:18 PM 2) Shah Forumben Manankumar Hundred and Fifty Four Only) as of 19/01/2024 Symbolic Possession Description of Secured Asset: All that piece and parcel of freehold immovable Property being Plot No. E/10 (As per Approved Plan Plot No.8), Having Super Plot Area admeasuring 600 Sq.yds., i.e. 501.67 Sq.mtrs., togetherwith Construction erected to erected standing thereon in the scheme known as "GREENLAND - THE ECO VILLAGE", situated and lying on non-agricultura land bearing Survey No.482 paiki of Moje Zamp, Taluka Sanand in the District Ahmedabad. Bounders by: East: Road, West: Sub Plot No.E/11, North: Road, South: Sub Plot No.E/9.

_				
3		1) M/s. Radhika Selection,	02/03/2024, Rs.58,81,799.43	D-4 45/05/0004
		Represented by its Proprietor Kishor	(Rupees Fifty Eight Lakhs Eighty One	Date: 15/05/2024
	45178640001485	Parmad Panjvani, 2) Kishor Parmad	Thousands Seven Hundred Ninety Nine and	Time: 03:50 PM
		Panjvani, 3) Panjvani Jeetu,	Forty Three Paise Only)	Symbolic Possession
		4) Jyotiben Parmand Panjvani	as of 27/02/2024	Cymbolic i ossessioi
	Deceription of Co.	oured Accet: All that piece and parcel	of the immercial property bearing	Shop No 24 on Croups

Description of Secured Asset: All that piece and parcel of the immovable Commercial property bearing Shop No.34 on Ground Floor, in The Scheme known as "HARIOM MARKET", Situated on City Survey No.1894/A/5 Sub Plot No.D, Mouje Railwaypura, Taluka City, District & Sub District Ahmedabad (admeasuring About 118 Sq.fts.). Boundaries: East Shop No.35 South: Passage, West: Shop No.33, North: Shop 31.

452486400008	1) M/s. Calcutta Jewelers, Represented by its Proprietor Karmkar Shushant Gurupad, 2) Mr. Karmkar Shushant Gurupad, Proprietor M/s. Calcutta Jewelers, 3) Renu Shushant Karmakar	09/01/2024, Rs.83,79,296.55 (Eighty Three Lacs Seventy Nine Thousand Two Hundred Ninety Six Rupees Fifty Five Paisa) as of 04/01/2024	Date: 15/05/2024 Time: 05:50 PM Symbolic Possession
--------------	--	---	---

Description of Secured Asset: All that piece and parcel of the Immovable property bearing as per Passing Plan Row House Plot No.53 admeasuring 184.32 Sq.mts. in "ANAND ROW HOUSE & APARTMENTS" situate at Revenue Suervey No.196/2/1 & 198, T.P Scheme No.12(Adajan), Final Plot No.96 admeasuring 2483 Sq.mts., of Mouje Adajan, City of Surat. Actual at Site

	Bounded on the:	North by: Entry and Road, South by:	Adj. Property, East by: Plot No.48, West by:	PIOT NO.54.
5	45248640000621	1) M/s. Vardhan Silk Mills,	02/03/2024, Rs.57,87,478.00	Date: 15/05/2024
	&	Represented by its Proprietor Rathi	(Rupees Fifty Seven Lakhs Eighty Seven Thousands Four Hundred and Seventy	Time: 05:00 PM
	45249660001133	Gopal Rathi, 4) Sumandevi Rathi	Eight Only) as of 27/02/2024	Symbolic Possession
	Description of Se	cured Asset: All that piece and parce	of the immovable property bearing Flat No.	601 admeasuring abou
ı	2090 Sq ft Situate	d on the 6 th Floor of Building No A of "A	MRUTKUN I COMPEX" constructed on land h	pearing final Plot No 195

		t 6889 Sq.mt. of T.P Schem No.9 of M		bearing linal Flot No. 19
6	31479630000237	1) Mehulkumar Mahendrabhai	02/03/2024, Rs.50,09,487.56	Date: 15/05/2024
	&	Patel,	(Rupees Fifty Lakhs Nine Thousand Four Hundred Eighty Seven and Fifty Six Paisa	Time: 11:22 AM
	32109630000127	2) Arpitaben Mehulkumar Patel	Only) as of 26/02/2024	Symbolic Possession
	paiki, admeasuring	25.13.04 in "Mashruvala Complex" s	ercial bearing Third Floor Shop No.21 out of R ituated at Sandesarpati Sim Ta. & Dist. Patar est by 1.22 mtr. Common passage in his side o	n. North by Third Floo

		,	st by 1.22 mtr. Common passage in his side of	,
7	31479630000237	1) Mehulkumar Mahendrabhai	02/03/2024, Rs.50,09,487.56	Date: 15/05/2024
	&	Patel	(Rupees Fifty Lakhs Nine Thousand Four Hundred Eighty Seven and Fifty Six Paisa	Time: 11:23 AM
	32109630000127		Only) as of 26/02/2024	Symbolic Possession
			of immovble Commercial Property being Shop	
88	"MASHRUWALA C	OMPLEX", which is situated in Block/ Su	rvey No.41P1/P2P of Sandesarpati Sim, Ta. & D	ist. Patan, North Gujara
8	450 400 40000007	1) M/s. Ramkrishna Textiles,	00/04/0004 B- 4 40 00 004 00	

45249660000590 45249660000169 & 45249660000818	2) Mr. Dipakkumar Ratilal Intwala, Proprietor Ramkrishna Textiles, 3) Pakhababan Intwala, A) Nikusi	(One Crore Forty Two Lakh Twenty Three Thousand Twenty Four Rupees and Ninety Paisa) as of 04/01/2024	Time: 05:00 PM Symbolic Possessio
Description of Sec	cured Asset: Property-1: All that piece	and parcels of land bearing Plot No.89 admea	suring about 103 Sq.m

Represented by its Proprietor

Dipakkumar Ratilal Intwala,

organized on land bearing Revenue Survey No.15/1/A, 15/2/A, 16/1 and it Block No.19 admeasuring about 32072 Sq.mt. of Unn Property-2: All that piece and parcels of land bearing Plot No.90 admeasuring about 103 Sq.mt. organized on land bearing Revenue Survey No.15/1/A, 15/2/A, 16/1 and it Block No.19 admeasuring about 32072 Sq.mt. of Unn within District Surat.

09/01/2024, Rs.1,42,23,024.90

Property-3: All that piece and parcels of land bearing Plot No.91 admeasuring about 103 Sq.mt. organized on land bearing Revenue Survey No.15/1/A, 15/2/A, 16/1 and it Block No.19 admeasuring about 32072 Sq.mt. of Unn within District Surat. Property-4: All that piece and parcels of land bearing Plot No.114 admeasuring about 103 Sq.mt. organized on land bearing Revenue Survey No.15/1/A, 15/2/A, 16/1 and it Block No.19 admeasuring about 32072 Sq.mt. of Unn within District Surat. Property-5: All that piece and parcels of land bearing Plot No.115 admeasuring about 103 Sq.mt. organized on land bearing Revenue Survey No.15/1/A, 15/2/A, 16/1 and it Block No.19 admeasuring about 32072 Sq.mt. of Unn within District Surat. Property-6: All that piece and parcels of land bearing Plot No.116 admeasuring about 103 Sq.mt. organized on land bearing Revenue Survey No.15/1/A, 15/2/A, 16/1 and it Block No.19 admeasuring about 32072 Sq.mt. of Unn within District Surat.

Whereas, the Borrowers/ Co-borrowers/ Guarantors/ Mortgagors, mentioned herein above have failed to repay the amounts due, notice is hereby is given to the Borrowers mentioned herein above in particular and to the Public in general that the authorized officer of Jana Small Finance Bank Limited has taken possession of the properties/ secured assets described herein above in exercise of powers conferred on him under section 13 (4) of the said Act read with Rule 8 of the said rules on the dates mentioned above. The Borrowers/ Co-borrowers/ Guarantors/ Mortgagors, mentioned herein above in particular and the Public in general are hereby cautioned not to deal with the aforesaid properties/ Secured Assets and any dealings with the said properties/ Secured Assets will be subject to the charge of Jana Small Finance Bank Limited.

Place: Ahmedabad Date: 18.05.2023

45248640000097

45249660000590

Sd/- Authorised Officer For. Jana Small Finance Bank Limited

Date: 14/05/2024

JANA SMALL FINANCE BANK

Registered Office: The Fairway, Ground & First Floor, Survey No.10/1, 11/2 & 12/2B, Off Domlur, Koramangla Inner Ring Road, Next to EGL Business Park, Challaghatta, Bangalore-560071. Regional Branch Office: 208 to 213, 2nd Floor, Shangrila Arcade, Above Saraswat Bank, 100 Feet Anand Nagar Road, Shyamal, Ahmedabad, Gujarat-380015





BAJAJ HOUSING FINANCE LIMITED

Corporate office: Cerebrum IT Park B2 Building 5th floor, Kalyani Nagar, Pune, Maharashtra 411014 Branch Office: AKSHAR MALL SECAND FLORE, Near ANAND chokdi above Bhayshri Mall Borsad, Ta/borsad, DI /anand 388540

POSSESSION NOTICE U/s 13(4) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002. Rule 8-(1) of the Security Interest (Enforcement) Rules 2002. (Appendix-IV)

Whereas, the undersigned being the Authorized Officer of M's BAJAJ HOUSING FINANCE LIMITED (BHFL) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued Demand Notice(s) to Borrower(s)/ Co-Borrower(s)/ Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The Borrower(s)/ Co-Borrower(s)/ Guarantor(s) having failed to repay the amount, notice is hereby given to the Borrower(s)/ Co-Borrower(s)/ Guarantor(s) and the public in general that the undersigned on behalf of M/s Bajaj Housing Finance Limited, has taken over the possession of the property described herein below in exercise of the powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8-(1) of the said rules. The Borrower(s)/Co-Borrower(s)/ Guarantor(s) in particular and the public in general are hereby cautioned not to deal with the below said property and any dealings with the said property will be subject to the first charge of BHFL for the amount(s) as mentioned herein under

Name of the Borrower(s)/Guarantor(s)	Description of Secured Asset	Demand Notice	Date of
(LAN No, Name of Branch)	(Immovable Property)	Date & Amount	Possession
Branch: ANAND LAN: H431RLP0450542 Borrower's: / Co borrower's: 1. AKASH CHIMANBHAI PATEL (Borrower), 2. SEJALBEN AKASHBHAI PATEL (Co-Borrower) At 3/261-1, Moti Golvad, Old Milk Dairy, Borsad, Gujarat-388540	All that piece and parcel of the Non-agricultural Property described as: All that right, title and interest of property Mouje Borsad Paiki City Survey No 1140, Paiki Akarni No 3/1140/1-2, Moti Golvad, Paiki total admeasuring 62-70-97 sq mtrs Paiki total construction admeasuring 30 sq mtrs Ta Borsad Dist Anand. East: House of Shubhashbhai Patel, West: Moti Golvad Road, North: House of Sureshbhai Rana, South: House of Bharatbhai Rana	28.02.2024 Rs.6,92,438/- (Rupees Six Lac Ninety Two Thousand Four Hundred Thirty Eight Only)	14-05-24

Place: Borsad Date: 18 May 2024

Sd/- Authorized Officer, Bajaj Housing Finance Limited



ULTRACAB (INDIA) LIMITED

Survey No. 262, Tel No.: +91 2827 - 253122 / 23 B/h. Galaxy Bearings Ltd., Fax: +91 2827 - 252725 Shapar (Veraval) - 360024 E-mail: cs@ultracab.in Dist. - Rajkot Gujarat web: www.ultracabwires.com

CIN: L31300GJ2007PLC052394

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31st MARCH, 2024

Sr.		Q	UARTER ENDE	ENDED	YEAR	YEAR ENDED	
Vo.	Particular	31.03.2024 AUDITED	31.12.2023 UNAUDITED	31.03.2023 AUDITED	31.03.2024 AUDITED	31.03.2023 AUDITED	
1	Total Income from Operations	4456.21	2204.98	2482.64	12405.56	10735.98	
2	Profit before Extra Ordinary and Exceptional Items	301.38	214.02	209.85	853.26	780.98	
3	Profit before Extra Ordinary Items and Tax	291.07	213.73	208.53	843.45	777.13	
4	Net Profit after Tax	177.06	164.34	172.30	597.83	581.70	
5	Total Comprehensive Income for the period (Net of Tax)	177.06	164.34	172.30	597.83	581.70	
6	Paid-up Equity Share Capital	1908.45	1908.45	1908.45	1908.45	1908.45	
7	Other Equity / Reserves (excluding Revaluation Reserve)	2		*	1887.75	1289.91	
8	Earning per Share (Face Value Rs. 02 per share) a) Basic (Rs.) b) Diluted (Rs.)	0.19 0.19	0.17 0.17	0.18 0.18	0.63 0.63	0.61 0.61	

SEBI (Listing Obligation and Other Disclosures Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results is available on the stock exchange website (www.bseindia.com) and Company's website (www.ultracabwires.com) 2. The above results are reviewed by the Audit Committee and were approved by the Board of Directors at its meeting held on

For and on behalf of Board of Directors of ULTRACAB (INDIA) LIMITED

Mr. Nitesh P. Vaghasiya

Chairman & Managing Director DIN: 01899455

Date: 17.05.2024





(Amt Rs. in Lakhs)



EDELWEISS ASSET RECONSTRUCTION CO. LTD. Edelweiss
Asset Reconstruction

Registered Office: Edelweiss House, Off CST Road, Kalina, Mumbai 400098 +91 22 4088 6090 / 6620 3149

APPENDIX IV-A [See proviso to rule 8(6) r/w proviso to rule 9(1)] SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY

E-Auction Sale Notice for sale of immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 ("SARFAESI Act") read with proviso to Rule 8(6) and proviso to Rule 9 (1) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and to the Borrower(s) and Guarantor(s) in particular that the below described immovable properties mortgaged to Edelweiss Asset Reconstruction Company Limited acting in its capacity as Trustee of EARC Trust SC-444 ("EARC"), the symbolic possession of Lot no.1 &2 which has been taken by the Authorized Officer ("AO") of EARC on February 01, 2023, and physical possession of Lot No. 3 to Lot No.24 as been taken by AO of EARC on May 19, 2023 will be sold by way of e-auction through e-auction agency, M/s e-Procurement Technologies Limited (Auction Tiger) on their website/portal, https://edelweissarc.auctiontiger.net on June 21,2024 at 10:00 am to 11:00 am with unlimited extension of 5 minutes each, if a bid is made before close of e-auction, on "As is where is", "As is what is", and "Whatever there is" basis, for recovery of Rs. 57,24,96,064/- (Rupees Fifty-Seven Crores Twenty-Four Lakhs Ninety-Six Thousand and Sixty-Four only) due as on June 30, 2022 together with further interest, charges & costs thereon till the date of actual payment/realization (after adjustment of all subsequent payments) recoveries) being due to EARC viz. Secured Creditor from M/s Takshashila Heights India Private Limited (hereinafter referred to as "Borrower").

Description of the Properties, its Reserve Price and Earnest Money Deposit described below shall be as follows:

Project Takshashila Elegna (Commercial): - Ellisbridge Town Planning Scheme No.3 varied (as per revenue records Town Planning Scheme No. 3/5) both situated at Village/Mouje - Chhadavad, Taluka Sabarmati (Formerly City Taluka) District Ahmedabad and Sub-District Ahmedabad – 3 (Memnagar) Gujarat Lot Unit No. Tower Type Floor Saleable Area Reserve Price FMD (Amount

Nos.	Unit No.	lower	Туре	Floor	(Sq. Ft.)	(Amount in Rs.)	in Rs.)
1.	A-1	Tower A	Commercial	Ground	1,204	3,37,60,331	33,76,033
2.	A-2	Tower A	Commercial	Ground	1,253	3,51,34,298	35,13,430
3.	A-3	Tower A	Commercial	Ground	1,338	3,75,17,710	37,51,771
4.	A-4	Tower A	Commercial	Ground	1,540	4,31,81,818	43,18,182
5.	A-5	Tower A	Commercial	Ground	1,441	4,04,05,844	40,40,584
6.	A-101	Tower A	Commercial	1st	3,158	5,68,69,378	56,86,938
7.	A-102	Tower A	Commercial	1st	1,043	1,87,82,382	18,78,238
8.	A-103	Tower A	Commercial	1st	1,177	2,11,95,458	21,19,546
9.	A-104	Tower A	Commercial	1st	1,295	2,33,20,407	23,32,041
10.	A-105	Tower A	Commercial	1st	1,540	2,77,32,376	27,73,238
11.	A-201	Tower A	Commercial	2nd	3,158	3,15,68,465	31,56,847
12.	A-202	Tower A	Commercial	2nd	1,043	1,04,26,190	10,42,619
13.	A-203	Tower A	Commercial	2nd	1,177	1,17,65,701	11,76,570
14.	A-204	Tower A	Commercial	2nd	1,295	1,29,45,270	12,94,527
15.	A-205	Tower A	Commercial	2nd	1,540	1,53,94,375	15,39,438
16.	A-301	Tower A	Commercial	3rd	3,158	2,83,95,025	28,39,503
17.	A-302	Tower A	Commercial	3rd	1,043	93,78,091	9,37,809
18.	A-303	Tower A	Commercial	3rd	1,177	1,05,82,946	10,58,295
19.	A-304	Tower A	Commercial	3rd	1,295	1,16,43,938	11,64,394
20.	Combined	Lot Nos. 1	to 5 (Ground fl	oor as whole)	6,776	19,00,00,000	1,90,00,000
21.	Combined	Lot Nos. 6	to 10 (First floo	or as whole)	8,213	14,79,00,000	1,47,90,000
22.	Combined	Lot Nos. 1	1 to 15 (Second	l floor as whole)	8,213	8,21,00,000	82,10,000
23.	Combined	Combined Lot Nos. 16 to 19 (Third floor as whole)				6,00,00,000	60,00,000

24. Project Tahshashila Air - Flat No. A/2402 at 24th Floor, Town Planning Scheme No. 3/5, within the Village limits of Chadavad, Taluka: Sabarmati and District and Registration District: Ahmedabad, Gujarat; together with the proportionate share in the said project land.

Floor Break up	Туре	Total Area in Sq. Ft.	Reserve Price (Amount in Rs.)	EMD (Amount in Rs.)
Flat No. A/2402 at 24th Floor	Residential	5,010	3,61,00,000	36,10,000

Increment in Bidding:- Rs.1,00,000/- (Rupees One Lakh Only for each property)

Date of Inspection of Secured Assets: 27th May, 2024 at 10:00 AM to 3:00 PM (for Lot no. 3 to Lot No. 24) Last Date of Submission of Bid:- Before 4.00 PM on 20th June 2024

e-Auction Portal / Helpdesk:- https://edelweissarc.auctiontiger.net / 099785 91888 / 092655 62818

Date & time of e-Auction:- 21st June 2024 at 10.00 AM to 11:00 AM with unlimited extensions of 5 minutes each

For detailed terms and conditions of the Auction Sale, please refer to the link provided in the Secured Creditor's website i.e. www.edelweissarc.in/Propertysale The interested bidders may remit the Earnest Money Deposit to the bank account of EARC, details are given below:

Bank: - ICICI Bank Ltd. A/c Name:- EARC TRUST SC 444 A/c No.000405131081 IFSC Code No. ICIC0000004 Branch:-Capital Market Division Before submitting the bids, prospective bidders are advised to visit the websites mentioned above and go through the bid

document containing the detailed terms and conditions of the E-auction. Date: 18/05/2024 **Authorized Officer** For Edelweiss Asset Reconstruction Company Limited, Phone No: 9829322130 Place: Mumbai

ADDENDUM TO FORM G INVITATION FOR EXPRESSION OF INTEREST FOR JBF INDUSTRIES LIMITED OPERATING IN POLYESTER CHIPS, POLYESTER YARN AND PROCESSED YARN AT INO UNIT AT PRESENT

Under Regulation 36A(1) of the Insolvency and Bankruptcy Board of India (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016) n supersession of earlier public announcement as issued by the undersigned regarding Invitation for expression of interest for submission of resolution plan in JBF Industries Limited on 04.05.2024, it is hereby informed that the revised timelines for submission of EOI will be as

-	RELEVANT PARTICULARS					
10,	Last date for receipt of expression of interest	03.06.2024				
11.	Date of issue of provisional list of prospective resolution applicants	13.06.2024				
12.	Last date for submission of objections to provisional list	18.06.2024				
13.	Last date of issuance of final list of prospective resolution applicant	28.06.2024				
14.	Date of issue of Information memorandum, evaluation matrix and request for resolution	01.07.2024				
15.	Last date of submission of resolution plans	31.07.2024				

Process email id to submit EOI cirp.jbf@gmail.com Note: The other contents & terms of the Form G dated 04.05.2024 shall remain the same. Further, the existing prospective resolution applicant(s) who have submitted their Expression

of Interest in response to FORM -G dated 04.05.2024, need not to submit again.

Date: 18/05/2024 Mukesh Verma Place: Mumbai Resolution Professional for JBF Industries Limited Regn. No.: IBBI/IPA-001/IP-P01665/2019-2020/12522 | AFA Validity : 17.12.2024 Add.: B1506, Avenue 2 Sunteck City, Goregaon West Mumbai 400104

FORM NO. URC-2 Advertisement giving notice about registration

under Part I of Chapter XXI of the Act [Pursuant to section 374(b) of the companies Act. 2013 and rule 4(1) of the companies (Authorised to Register) Rules, 2014]

. Notice is hereby given that in pursuance of subsection (2) of section 366 of the Companies Act, 2013, an application is proposed to be made after fifteen days hereof but before the expiry of thirty days hereinafter to the Registrar at Gujarat, Ahmedabad that HKRP Innovations LLP (LLPIN: AAM-3689) a LLP may be registered under part I of chapter XXI of the Companies Act 2013, as a Company limited by

2. The principal objects of the Company are as follows: -

Providing "Energy Solutions" like Renewable Energy - GEDA for Solar Pump Remote Monitoring Solutions "Transmission & Distribution" - Sub-Station Monitoring Solutions - GETCO, DISCOM's and "Telemetry Solutions - SLDC":

ii. "Energy Efficiency" - Energy Monitoring Solutions with Auditing - GEDA, Smart City and Streetlight Monitoring and Operations - Smart City:

v. "Township/Industrial Distribution" - Smart Estate GIDC for Water Distribution & Metering, Electricity Distribution & Metering, Streetlight & Metering; v. "Plant Wide Energy Monitoring" - GSFC

GACL/GSPC/IOCL/ONGC/Ports - Water Gas Electricity Renewable Energy Monitoring. A copy of the draft memorandum and articles of

association of the proposed company may be inspected at the office at #380/3, Siddhi House, B/h Kamaldeep Appts., Lal Bunglow, Ellisbridge, Ahmedabad, Gujarat - 380006, India. Notice is hereby given that any person objecting to

this application may communicate their objection in writing to the Registrar at Central Registration Centre (CRC), Indian Institute of Corporate Affairs (IICA), Plot No. 6,7,8 sector 5, IMT Manesar, District Gurgaon (Haryana), Pin Code - 122050, within 21 days from the date of publication of this notice, with a copy to the company at its registered office

Dated this 18th (Eighteenth) day of May, 2024 Name of the Applicant

KURANG RAMCHANDRA PANCHAL (Designated Partner) JAYESH AMRATLAL GANDHI (Designated Partner) NEHAL RAMCHANDRA PANCHAL (Designated Partner) PAVAN M. (Designated Partner) VISHAL HEMANTKUMAR PATEL (Designated Partner KAXIL PRAFULBHAI PATEL (Designated Partner) VINESH BHOGILAL SONI (Designated Partner) RAJENDRA BALDEVBHAI PATEL (Designated Partner) PALLAV JAYESHKUMAR GANDHI (Designated Partner)

DAXESH RAMCHANDRA PANCHAL (Designated Partner)

KAILASH JAYESH GANDHI (Designated Partner)

PRAFUL BALDEVBHAI PATEL (Designated Partner

GUJCHEM DISTILLERS INDIA LIMITED

CIN: L74110GJ1939PLC002480 Registered Office: Survey No. 146, Plot No. 314, 307, 3rd Floor, Ashirwad Paras-1, S. G. Highway, Makarba, Ahmedabad -380051, Gujarat Email: gujchemdistillers@gmail.com | Website: www.gujchemdistillers.in

NOTICE OF EXTRA-ORDINARY GENERAL MEETING AND REMOTE E-VOTING NOTICE IS HEREBY GIVEN that Extra-Ordinary General Meeting ("EGM") of the members of Guichem Distillers India Limited ("Company") will be held on Saturday, June 08, 2024 at 12.00 P.M. at the Registered Office of the Company at Survey No. 146, Plot No. 314, 307, Third Floor, Ashirwad Paras-1, S. G. Highway, Makarba, Ahmedabad - 380051, Gujarat to transact business as mentioned in EGM notice & seek approval of shareholders of the company for following resolutions: -

Sr. Resolution seeking approvals of the Shareholders in the EGM

1. Issue of Compulsory Convertible Debentures ("CCDs") on Preferential basis 2. Issue of Convertible Warrants on Preferential basis

3. Alteration of Main Object Clause of Memorandum of Association of the Company

In compliance with the aforesaid MCA Circulars and Securities and Exchange Board of India (SEBI) Circular No. SEBI/HO/CFD/PoD-2/P/ CIR/2023/4 dated January 05, 2023, Notice of the EGM is being sent only through electronic mode to those members whose e-mail addresses are registered with the Company/Depository Participants, unless any member has requested for a physical copy of the same. The Notice can also be accessed from the website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com. For members who have not registered their email address, may write to the Company at gujchemdistillers@gmail.com. Pursuant to Regulation 46 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations") and in line with the MCA Circulars, the Notice calling Extra Ordinary General Meeting ("EGM") has been uploaded on the website of the Company at www.gujchemdistillers.in. The Notice can also be accessed from the website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com.

The Notice of EGM has been sent through email to all the members on Thursday. May 16.

The remote e-voting period begins on Wednesday, June 05, 2024 at 9.00 a.m. and ends on Friday, June 07, 2024 at 5.00 p.m. for the shareholders of the Company. During this period, shareholders of the Company holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date June 01, 2024 may cast their vote electronically. The e-voting module shall be disabled by CDSL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently. The facility for voting through ballot paper shall also be made available at the meeting and members attending the meeting who have not already cast their vote by remote e-voting shall be able to exercise the right at the meeting. The members who have cast their vote by remote e-voting prior to the meeting may also attend the meeting but shall not be entitled to cast their vote again.

A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the EGM through ballot paper. Any person, who acquires shares of the Company and become member of the Company after sending the Notice of EGM and holding shares as on the cut-off date, may obtain the login ID and password by sending a request at helpdesk, evoting@cdslindia.com.

In line with the Ministry of Corporate Affairs General Circular No. 17/2020 dated 13th April, 2020, the Notice calling EGM has been uploaded on the website of the Company at www.gujchemdistillers.in . The Notice can also be accessed from the websites of the Stock Exchange i.e., BSE Limited at www.bseindia.com. The EGM Notice is also disseminated on the website of CDSL (agency for providing the Remote e-Voting facility) i.e. www.evotingindia.com.


In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com. under help section or write an email to helpdesk, evoting@cdslindia,com or call 022-23058542/43. All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Manager, Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N.M. Joshi Marg, Lower Parel (East), Mumbai-400013, Maharashtra or send an email to helpdesk.evoting@cdslindia.com or call 022-23058542/43.

Date: 17.05.2024

Place: Ahemedabad

By Order of the Board of Directors For, Gujchem Distillers India Limited

> Sagar Samir Shah Chairman and Director DIN: 03082857



નં. ૧૦/૧૨૧/૨૦૧૬–એ નસીએલટી (પીટી–૪) નેશનલ કંપની લો ટીબ્ચનલ

સીજીઓ કોમ્પલેટ્સ, લોધીરો: નવી દિલ્હી–૧૧૦૦૦

વેષય: પ્રતિનિયુક્તિના આધારે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ બેન્ચમાં કેપ્યુટી રજીરદ્રારની જગ્યાઓની ભરત નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (એનસીએલટી) નીચેની જગ્યાઓની ભરતી માટે નીચે જણાવેલ વિગતો મુજબ

તેની શાખાઓમાં વર્તમાન/ભાવી જગ્યાઓની ભરતી માટે અરજીઓ મંગાવે છે.								
ક્રમ નં	જગ્યા	બેન્ય પગાર ધોરણ		જગ્યાની સંખ્યા				
	(કામચલાઉ)							
٩	૧ કેપ્યુટી રજીસ્ટ્રાર		वेवस –१२ (३१.७८८००–	٩				
			5 0€500)					
૨. ચુંટાચેલ ઉમેદવારે તે/તેણી જે એનસીએલટી બેંચ માટે ચુંટાચા છે તેમાં સેવા આપવી જરૂરી છે								
૩.અરજારમો જમા કરવાની છેલી તારીખરોજગાર સમાચાર /એમાલોસમેન્ટ ન્યુજમાં જાઠેરાત પ્રસિદ્ધ								

થયાની તારીખથી દ૦ દિવસ રહેશે.

૪.વધુ વિગતો માટે <u>www.nclt.gov.in</u> (કેરીચ૨ હેઠળ)ની મુલાકાત લેવી

(નવીનકુમાર કરવપ સેકેટરી ઇન ચા નેશનલ કંપની લો ટ્રીબ્યુન

સહી

ફોર્મ જી માં વદ્યારો

એક્સપ્રેશન ઓફ્ ઇન્ટરેન્સટને આમંત્રા પોલીસ્ટર ચીપ્સ, પોલીસ્ટર ચાર્ન અને પ્રોસેસ્ડ ચાર્નમાં કાર્ચરત જીબીએફ ઇન્ડસ્ટઢીઝ લીમીટેડ માટે (હલા કોઈ ચુનિટ નથી) ઈન્સોલ્વેન્સી અને બેંક્સ્પ્ટસી બોર્ડ ઓફ ઇન્ડિયા (કોર્પોરેટ પર્સન્સ માટેનીાઇન્સોલ્વેન્સી

રીઝોલ્યુશન પ્રક્રિયા) નિયમનો, ૨૦૧૬ ના નિયમન ૩૬એ(૧) હેઠળ

૦૪.૦૫.૨૦૨૪ના રોજ જેબીએફ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડમાં રીઝોલ્યુશન પ્લાન જમા કરવા માટે એક્સ્મોશન ઓક ઇન્ટરેસ્ટ માટે આમંત્રણના સબંધમાં નીચે સહી કરનાર દ્વારા જારી કરાયેલ જુની સાર્વજનિક જાહેરાતના અધિક્રમણમાં, આથી જાણકરવામાં આવે છે કે ઈઓઆઈ જમા કરવા માટે

garca con ac on a grown con.	
સંબંધિત વિગતો	
 એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જમા કરવાની છેલી તારીખ 	03.05.2028
૧૧. ભાવી રીઝોલ્યુશન અરજદારોની કામચલાઉ યાદી જારી કરવાની તારીખ	93.05.2028
૧૨. કામચલાઉ ચાદીમાં વાંધાઓ જમા કરવાની છેલી તારીખ	१८.०६.२०२४
છ. ભાવી રીઝોલ્યુશન અરજદારોની અંતિમ ચાદી જારી કરવાની તારીખ	२८.०६.२०२४
જ્ઞ. માહીતી મેમોરેન્ડમ, મુલ્યાંડન મેટ્રીક્સ અને રીઝોલ્યુશન માટેની અરજી જારી કરવાની તારીખ	09.09.2028
૧૫. રી ઝોલ્યુશન પ્લાનો જમા કરવાની છેલી તારીખ	39.00.2028
૧૬. ઇઓઆઇ જમા કરવા માટે પ્રક્રિયા ઇમેઇલ આઇડી cirp.jbf@gmail.com	
નોંદા: ક્ષેમં જીતારીખ ૦૪.૦૫.૨૦૨૪ની અન્ય વિગતો અને શરતો ચચાવત રહેશે. આઉપરાંત, ફોર્મ-જીતારીખ ૦૪.૦૫.૨૦૨૪ના સંદર્ભમાં જેત્માવી રીઝોલ્યુશન અરજદાર(રો)એ તેમના એક્સાં બમા કરેલ છે, તેમણે ફરીથી જ્યા કરવાની જરૂરી નથી.	
413hu: 0.4 ou acay	34A/

^4-001/IP-P01665/2013-2020/12622 | એરમેફ્રમે માન્યતા: ૧૭.૧૨.૨૦૨૪ સરનામું: બીવપ0દ, એવન્યુ ૨, સનટેક સીટી, ગોરેગોંવ વેસ્ટ, મુંબઇ – ૪૦:

🚳 🛦 લ 😘 આવાસ ફાયનાન્સિયર્સ લીમીટેડ

(અગાઉ એયુ હાઉરોીંગ ફ્રાયાનાન્સ લીંમી ટેક તરીકે જાણી તી) (CIN :1.69922R.12011PL.C034297) રજી. અને કોર્પો. ઓફીસ : ૨૦૧–૨૦૨, બીજો માળ, સાઉથ એન્ડ સ્કવેર, માન સસેવર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, જ્યપુર–૩૦૨૦૨૦

કબજા નોટીસ

જત જણાવવાનું કે નીચે સહી કરના<mark>ર આવાસ ફાયનાન્સિયર્સ લીમીટેક (અગાઉ "એયુ હાઉસીંગ ફાયનાન્સ લીમીટેક તરીકે જાણીતી")</mark> ના અધિકૃત અધિકારીએ સિક્યોરિટાઇઝેશન અને રિકન્ટ્રેક્શન ઓ ફ ફાયનાન્શિયલ એસેટ અને એન્ફોર્સમેન્ટ ઓ ફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એ ક્ટ,૨૦૦૨ હેઠળ અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૯ સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ મને મળેલ સત્તાનો ઉપયોગ કરીને જણાવેલ નોટીસની બજવણીની તારીખથી દૃ૦ દિવસની અંદર સંબંધિત નોટીસમાં નીચે જણાવલે રકમ ચુકવી જ્વા દેવાદારોને માંગણાં નોટીસ પાઠવી હતી . દેવાદારો રકમની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ જતાં જણાવેલ નિયમોના નિયમ ૯ સાથે વંચાતી જણાવેલ કાયદાની કલમ ૧૩(૪) હેઠળ મળેલી સત્તાની રૂએ નીચે જણાવેલે મિલકતોનો કબજો નીચે જણાવેલ તારીખોએ લઇ લીધો છે. ખાસ કરીને દેવાદારો અને જામીનદારોને અને જાહેર જનતાને અહી સાવધ કરવામાં આવે છે કે મિલકતો સાથે કોઇ વ્યવહાર કરવો નહી અને મિલકત સાથેનો કોઇપણ વ્યવહાર **આવાસ ફાયળાન્સિયર્સ લીમીઢેક (અગાઉ ''એયુ હાઉસીંગ ફાયળાન્સ લીમીઢેક તરીકે જાણીતી'') ના અહીં નીચે જ્યાવેલ સ્કમ અને** તેના પરનાં ચડત વ્યાજને આધિન રહેશે.

દેવાદારનું નામ	નારીખ અને રકમ	મિલકતની વિગત	તારીખરાને પ્રકાર
ચિંતન રાઠોડ, શારદાબેન રાઠોડ, સુરેશભાઇ રાઠોડ (A/c No.) LNJUN00315-160016607	૧૨–૦૩–૨૪ રૂા. ૪૯૦૪૫૮.૪૧/– ૧૧–૦૩–૨૪ મુજબ	રેસિડેન્સીચલ હાઉસનો બ્લોક નં. ફ, બાંધકામ જમીનનો પ્લોટ નં. દ્દકુ પૈકી મધ્ય બાજુનો સબ પ્લોટ નં. દુ૭-બી, પ્રેરણધામ– ૨, ખામધ્રોલ, જિતો–જુના ગઢ. સેત્રફળ પ૪.૨૦ થો.મી .	૧૭–૦૫–૨૪ નાં રોજ સાંકેતિક કબજો લીધો
સ્વ. શ્રી વિહાભાઇ શકરાભાઇ ભોઇ, જીવતબેન વિહાભાઇ ભોઇ, અશોકભાઇ વિહાભાઇ ભોઇ, ચમનભાઇ ભોઇ, જીવતબેન વિહાભાઇ ભોઇ, અશોકભાઇ વિહાભાઇ ભોઇ (A/c No.) LNNAR00516-170035647	૧૨–૦૩–૨૪ રૂા. ૩૫૪૭૩૬/– ૧૧–૦૩–૨૪ મુજબ	મિલકત નં. ૩૩૬, 'ભક્ત વાસ', મોજે-ચિલોડા, તાલુકો-ગાંધીનગર. સેત્રફળ ૪૦૦ ચો. ફુટ	૧૭–૦૫–૨૪ નાં રોજ સાંકેતિક કબજો લીધો
રથળ : જ્થાપુર તારીખ : ૧૮–૦૫–૨૦૨૪		અધિકૃત અધિકારી - આવાસ ફાયનાવિ	સચર્સ લીમીટેક



CBC/07118/12/0003/2425

Home First Finance Company India Limited

CIN: L65990MH2010PLC240703,

Website: homefirstindia.com Phone No.: 180030008425 Email ID: loanfirst@homefirstindia.com

ખાનગી સંધિ દ્વારા વેચાણની નોટીસ

સિક્ચોરીટાઇગ્રેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૧૦૦૧ હેઠળ સિક્ચોર્ડ એસેટનું વેચાણ (નિયમ ૮(૬) હેઠળ) હોમ કરર્ટ કાયનાન્સ કંપની ઇન્ડિયા લીમીટેડ (હોમ કરર્ટ) ના નીચે રાહી કરનાર અધિકૃત અધિકારીએ તમારા પાસેથી ચુકવવાપાત્ર બાકી રકમના સંબંધમાં ઉક્ત એક્ટની કલમ ૧૩ (૪) હેઠળ શીડ્યુલ વિગતનો કબજો

આથી જાહેર જ્નતાને જાણ કરવામાં આવે છે કે શીક્યુલમાં જણાવેલ સિક્યોર્ડ મિલક્ત(તો) ''જ્યાં છે'' અને ''જે છે'' ના ધોરણે કંપનીની બાકી રકમની વસુલાત માટે કંપનીને માન્ય શસ્તો મુજબ ખાનગી સંઘિદ્વાસ વેચાણ માટે ઉપલબ્ધ રહેશે પરિણામે, જણાવેલ એક્ટ અને તે હેઠળના નિયમોની જોગવાઇઓ મુજબ, અમે આ નોટીસની તારીખથી ૧૫ દિવસની અંદર કંપનીની બાકી રકમમાંથી છુટકારો મેળવવા અને શીડ્યુલમાં જણાવેલ મિલકતો પસ્ત લેવા માટે આ નોટીસ જાર્ર કરીએ છીએ, જેમાં નિષ્ફળ જતાં મિલકતો બાકી રકમની વસુલાત માટે વેચવામાં આવશે. આ જણાવેલ એક્ટ અથવા કોઇ અન્ય લાગુ કાયદાઓ હેઠળ કંપનીને પ્રાપ્ત કોઇપણ અન્ય હેર્ને પ્રત્યે પુર્વગ્રહ વગરની છે. રસ ધરાવતી વ્યક્તિઓ વધુ વિગતો/સ્પષ્ટતાઓ અને તેમની ઓફરો જમા કરવા માટે અધિકૃત અધિકારીનો સંપર્ક કરી શકે છે. વેચાળ સરફૈરી એક્ટ/નિયમોની જોગવાઇઓ અનુસાર રહેશે

ક્રમ નં.	દેવાદાર(રો) અને સહ-દેવાદાર(રો) નામ	મિલકતનું સરનામું	માંગણા નોટીસની તારીખે કુલ બાકી રકમ (રૂ.)માં	વેચાણ નોટીસની તારીખ	સમાચારપત્ર	ઇ–હરાજીની તારીખ	રિઝર્વ કિંમત (રૂા.) માં	અદ્યિકૃત અદ્યિકારીનો સંપર્ક નંબર
1.	સુલ્તાનશા, સુલ્તાનશા	હાઉસ નં. – સબ પ્લોટ નં. ૧૬/૩, રેવન્થુ સર્વે નં. ૨૪૩/પૈકી, પ્લોટ નં. ૧૬/પૈકી, સબ પ્લોટ નં. ૧૬/૩, 'ખોજા સોસાયટી', ભાલગામડા ગેટ પાસે, મુકામ–લિંબડી, સરેન્દ્રનગર, ગુજરાત–૩૬૩૪૨૧		16-04-2024	ફાયનાન્સિયલ એક્સપ્રેસ (ઇગ્લીશ + ગુજરાતી)	17-05-2024	16,04,047	8329863054

સરફૈસી અદિાનિયમ, ૨૦૦૨ હેઠળ ૧૫ દિવસની વેચાણ નોટીસ આથી દેવાદાર/જામીનદારોને માંગણા નોટીસમાં જણાવેલ ૨કમ તેમજઅંતિમ તારીખ સધીનું વ્યાજઅને આકરિમક ખર્ચ આ નોટીસની તારીખથી ૧૫ દિવસની અંદર ચુકવવા જણાવામાં આવે છે, જેમાં નિષ્ફળ જતાં મિલકતની હરાજી/વેચાણ કરવામાં આવશે અને બાકી સ્કમ, જો કોઇ હોય તો ચાજઅને ખર્ચ સહીત વસુલવામાં આવશે.

તારીખ : ૧૮.૦૫.૨૦૨૪ રથળ : સુરેન્દ્રન ગર સહી/– અધિકૃત અધિકારી, હોમ ફરર્ટ ફાયળાવ્સ કંપળી ઇન્ડિયા લીમીટેડ

એચુ સ્મોલ ફાચનાન્સ બેંક લીમીટેડ (શક્યુલ્ક કોમસિયલ બેંક)

૨જીસ્ટર્ડ ઓફ્રીસ : ૧૯−એ, ધુલેશ્વર ગાર્ડન, અજમેર રોડ, જ્યપુર–૩૦૨૦૦૧ (CIN∶L36911RJ1996PLC011381) પરિશિષ્ટ –૪ (જુઓ નિચમ ૮ (૧)) કળજા નોટીસ

જત જણાવવાનું કે, સિક્ચોરીટાઇઝેશન અને રીકનસ્ટ્રક્શન ઓફ્ ફાચનાન્સિયલ એસેટ અને એન્ફોર્સમેન્ટ ઓફ્ સિક્ચોરીટીઇન્ટરેસ્ટ (એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ની ૫૪) હેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ(એન્ફોર્સમેટ) નિચમો, ૨૦૦૨ નાં નિચમ (૩) સાથે વંચાતી ક્લમ ૧૩ (૧૨) હેઠળ વાંચીને મળેલી સત્તાની રૂએ **એચુ ૨મોલ ફાયનાન્સ બેંક લીમીટેડ (શિક્યુલ્ડ કોમર્સિયલ બેંક)** ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ નીચે કોષ્ટકમાં જ્યાવેલ વિગતો અનુસાર જ્યાવેલ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર જ્યાવેલ નોટીસમાં જ્યાવેલ રકમો ચુકવવા માટે નીચે જ્યાવેલ દેવાદોરોને માંગણાં નોટીસ જારી કરી હતી.

દેવાદારો/સહ–દેવાદારો/ગીરવેદાર/ જામીનદારોનાં નામ/ લોન નંબર	૧૩(૨) નોટીસની તારીખ અને રકમ	ગીરો મિલકતની વિગત	કળજો લીધાની તારીખ
(A/cNo.) L9001060126502724, સોમાભાઈ લખીરામભાઈ જોષી (દેવાદાર), સિરવાડિયા ધવલકુમાર સોમભાઈ (સહ– દેવાદાર), શ્રીમતી જોષી શાંતાબેન સોમાભાઈ (સહ–દેવાદાર)	૧૩-૧૦-૨૩ ગ્ર. ૩,૯૨,૨૫૫/- (રૂપિયા ત્રણ લાખ બાણું હજાર બસ્સો પંચાવન પુરા) ૧૦-૧૦-૨૩ મુજબ	મિલકત નં. સ્ટ/૧ શિરવાડા, તાલુકો કાંકરેજ, જિલો બનાસકાંઠા, ગુજરાત પાતેની રેસીડેન્સીયલ / કોર્મસીયલ જમીન / બિલ્ડીંગ/સ્ટ્રક્ચર અને ફીક્ચર્સના તમામ ભાગ અને હિસ્સા. ન્નેત્રફળ ૨૪૯૦ ચો.ફુટ	43-04-5 8
(A/cNo.) L9001060719015892, અસ્માન કુટવેર (દેવાદાર), મેમન હમિદભાઈ ઇસ્માઈલભાઈ (સહ–દેવાદાર), રિજવાન હમિદભાઈ મેમન (સહ–દેવાદાર)	વર-૦૧-૨૪ ગ્રા. ૧૪,૦૫,૩૧૬/- (રૂપિયા ચૌદ લાખ પાંચ હજાર ગ્રણસો સોળ પુરા) ૧૦-૦૧-૨૪ મુજબ	મ્લુન્સિપલ કોર્પોરેશન, સર્વે નંબર/મ્યુન્સિપલ નંબર દૃ૧૭/બી/ર૭ ૩૬/ર પૈકી પ્લોટ નં. ૨૭૦, નગર પાલિકા સેન્સસ નં. બીરદૃ ૧ એસેસમેન્ટ નં. એ દૃ૪૫૨ એમ જે અમિન કોમ્પલેક્ષ સ્કીમ નં. ૨, પહેલો માળ, મોજે દહેગામ, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૩૦૫, ખાતેની રેસીડેન્સીયલ/ કોર્મસીયલ જમીન / બિલ્ડીંગ/સ્ટ્રક્ચર અને ફીક્ચર્સના તમામ ભાગ અને હિસ્સા. ફેત્રફળ ૨૧.૭૭ ચો.મી .	૧૩–૦૫–૨૪
(A/cNo.) L9001070130600197, રાજ્યુત સુરેન્દ્રસિંઘ (દેવાદાર) શ્રીમતી રાજ્યુત મોની સુરેન્દ્રસિંઘ (સહ– દેવાદાર)	૧૩–૦૨–૨૪ ગ્રા. ૧૨,૪૪,૮૫૩/– (રૂપિયા બાર લાખ યુમ્માલીસ હજાર આઠસો ત્રેપન પુરા) ૧૨–૦૨–૨૪ મુજબ	ડેવલોપમેન્ટ ઓથોરીટી– સર્વે નં. ૪૯૯, જુનો સર્વે નં. ૧૬૧/૧ ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૧૧૮, સિંગરવા ફાઈનલ પ્લોટ નં. ૭૫, ફ્લેટ નં. ૬૦૧, ફ્લોર નં. ૬, બેલક નં. એ, શ્યામ હાઈટ્સ, તાલુકો દસ્કોઈ, જિલો અમદાવાદ, ગુજરાત ખાતેની રેસીડેન્સીયલ / કોર્મસીયલ જ્ભીન / બિલ્ડીંગ/સ્ટ્રક્ચર અને ફીક્ચર્સના તમામ ભાગ અને હિસ્સા. ક્ષેત્રફળ 33.૫૫ ચો.મી.	93-04- 28
(A/cNo.) L9001070129779701, સંતકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા (દેવાદાર) શ્રીમતી માચા સંતકુમાર ગુપ્તા (સહ-દેવાદાર)	૧૫–૦૪–૨૩ ગ્રા. ૨૧,૯૧,૩૮૭/– (રૂપિચા એક્વીસ લાખ એક્કાણું હજાર ત્રણસો સીત્યાસી પુરા) ૧૨–૦૪–૨૩ મુજબ	હાઉસ નં. ૭૧/૧૭૧, ફ્લેટનં. ૩૦૨, સર્વે નં. ૧૨૮૭, ૩જો માળ, સુભાષ મંગલ ૧, ગામ નંદવાલા, તાલુકો અને જિન્નો વલસાડ, ગુજરાત ખાતેની રેસીડેન્સીયલ / કોર્મસીયલ જમીન / બિલ્ડીંગ/સ્ટ્રક્ચર અને ફીક્ચર્સના તમામ ભાગ અને હિસ્સા. સેત્રફળ ૧૧૬.૨૭ ચો.મી. પુર્વ – ફ્લેટ નં. ૩૦૧, પશ્ચિમ: માર્જિનલ સ્પેશ, ઉત્તર: કોમન પેસેજ, દક્ષિણ: માર્જિનલ સ્પેશ	૧૪-૦૫-૨૪
(A/cNo.) L9001060122838783, ડાભી વિનુભાઇ માનસંગભાઇ (દેવાદાર) શ્રીમતી મંજુલાબેન ડાભી (સહ–દેવાદાર)	૧૩–૧૦–૨૩ ગ્ર.૧,૯૨,૧૭૩/– (ગ્રુપિયા એક લાખ બાધું હજાર એક્સો તોત્તેર પુરા) ૧૦–૧૦–૨૩ મુજબ	મિલકત નં.૮૦૦, ગામ વાદ્યી, તાલુકો તારાપુર, જિલો આણંદ, ગુજરાત ખાતેની રેસીડેન્સીયલ / કોર્મસીયલ જ્લીન / બિલ્ડીંગ/સ્ટ્રક્ચર અને ફીક્ચર્સના તમામ ભાગ અને હિસ્સા. ફોત્રફળ ૧૩૧૧.૫ ચો.ફૂટ . પુર્વ: રોડ, પશ્ચિમ: રોડ, ઉત્તર: સંજ્યભાઇની શોપ, દક્ષિણ: પશાભાઇનું ઘર	૧૪–૦૫–૨૪
(A/cNo.) L9001060824060865, સેવંતીભાઈ કેશાભાઈ સોલંકી (દેવાદાર) જ્યશ્રીબેન સેવંતીલાલ સોલંકી (સહ- દેવાદાર)	વર-૦૭-૨૨ ગ્ર. ૩,૪૬,૯૨૧/- (રૂપિયા ત્રણ લાખ છેત્તાલીસ હજાર નવસો એકવીસ પુરા) ૧૨-૦૭-૨૨ મુજબ	મિલકત નં. ૩૪૨, ગામતલ, મેઇન બજાર, ગામ ઉન, તાલુકો કાંકરેજ, જિલો બનાસકાંઠા, ગુજરાત ખાતેની રેસીડેન્સીચલ / કોર્મસીચલ જમીન / બિલ્ડીંગ/સ્ટ્રક્ચર અને ફીક્ચર્સના તમામ ભાગ અને હિસ્સા. સેત્રફળ ૨૬,૪૪ ચો.ચાર્ડ . પુર્વ: શાહ અરવિંદભાઇ પુનમચંદની શોપ, પશ્ચિમ: ઉન બાલવાટિકા, ઉત્તર: જાહેર રસ્તો, દક્ષિણ: જૈન સમાજ ડેલો	૧૫-૦૫-૨૪
(A/c No.) L9001060122297897, શૈલેષભાઈ વાલજીભાઈ ઠક્કર (દેવાદાર) શ્રીમતી સુમનબેન શૈલેષભાઈ ઠક્કર (સહ– દેવાદાર) પ્રકાશભાઈ વાલજીભાઈ ઠક્કર (સહ–દેવાદાર)	૨૨–૦૩–૨૩ ગ્ર.૪,૮૪,૦૯૨/– (રૂપિયા ચાર લાખ ચોર્ચાસી હજાર બાણું પુરા) ૨૧–૦૩–૨૩ મુજબ	પ્લોટ નં. ૯૪ પૈકી, પશ્ચિમ બાજુ (દ્દ ૪.૭૫ ચો.મી) અને ૯૫ પૈકી પુર્વ બાજુ (૧૯.૫૦ ચો.મી.), રેવન્ચુ સર્વે નં. ૨૯/૧, (નવો સર્વે નં. ૮૫), મોજે તાના, તાલુકો કાંકરેજ, જિલો બનાસકાંઠા, ગુજરાત ખાતેની રેસીડેન્સીચલ / કોર્મસીચલ જ્મીન / બિલ્ડીંગ/સ્ટ્રક્ચર અને ફીક્ચર્સના તમામ ભાગ અને હિસ્સા. ન્નેત્રફળ ૮૮.૮ ચો.ચાર્ડ . પુર્વ: પ્લોટ નં. ૯૪, પશ્ચિમ:પૈકી પ્લોટ નં. ૯૫, દક્ષિણ: પૈકી રોડ કોમન પ્લોટ	૧૫–૦૫–૨૪
(A/c No.) L9001060120258921, રૂદ્ર શુંગાર એન્ડ કટલરી, તેના પ્રોપસચર રામચંદ્ર પાલ મારફત, રામચંદ્ર પાલ (સહ– દેવાદાર), સભાજીત રામકિશોર પાલ (સહ– દેવાદાર)	૧૭–૦૪–૨૩ ગ્ર.૮,૮૯,૫૩૩/– (રૂપિયા આઠ લાખ નેવ્યાસી હજાર પાંચસો ત્રેપન પુરા) ૧૭–૦૪–૨૩ મુજબ	એ/ર, પહેલો માળ, સનરાઈઝ રેસીડેન્સી, રેવન્થુ સર્વે નં. ૨૧૪, પ્લોક નં. ૨૫૬, નક્ષમ રજી.પ્લોટ નં. ૪૨૯, ૪૩૦, ૪૩૧, ૪૪૨, ૪૪૩, ૪૪૪, મોજે જોલ્વા, પેટા જિદ્યો પલસાણા, જિદ્યો સુરત, ગુજરાત ખાતેની રેસીડેન્સીચલ / કોર્મસીચલ જ્મીન / બિલ્ડીંગ/સ્ટ્રક્ચર અને ફીક્ચર્સના તમામ ભાગ અને હિસ્સા. ન્નેત્રફળ ૩૪૦ ચો.ફૂટ , પુર્વ: રોડ, પશ્ચિમ: રોડ, ઉત્તર: પ્લોટ નં. ૪૩૨, દક્ષિણ: ત્રકૃષિ મંડીની બાઉન્ડ્રી	૧૫–૦૫–૨૪
(A/cNo.) L9001060814197166, શ્રીમતી પુષ્પાબેન (સહ–દેવાદાર અને રવ. શ્રી ડબગર સુરેશભાઇ – દેવાદારના કાનુની વારસદાર), રાહુવકુમાર સુરેશભાઇ ડબગર (સહ–દેવાદાર અને સ્વ. શ્રી ડબગર સુરેશભાઇ – દેવાદારના કાનુની વારસદાર)	૦૬-૦૫-૨૩ ગ્ર.૫,ર૧,૩૫૨/- (રૂપિયા પાંચ લાખ એક્વીસ હજાર ત્રણસો બાવન પુરા) ૦૪-૦૫-૨૩ મુજબ	ફ્રીહોલ્ડ, મ્યુન્સિપલ હદમાં, પ્લોટ નં. ૫, બસ સ્ટેશન ગોધરા લુનાવાડા, હાઇવે, શહેરા, જિલો પંચમહાલ, ગુજરાત ખાતેની રેસીડેન્સીચલ / કોર્મસીચલ જમીન / બિલ્ડીંગ/સ્ટ્રક્ચર અને ફીક્ચર્સના તમામ ભાગ અને હિસ્સા. ન્નેત્રફળ ૭૧.૧૦ ચો.મી. પુર્વ: ખાનગી રોડ, પશ્ચિમ: ગોધા લુનાવાડા હાઇવે, ઉત્તર: પ્લોટ નં. દૃ, દક્ષિણ: પ્લોટ નં. ૪	૧૫–૦૫–૨૪
(A/cNo.) L9001060700652721, રીડમલાલસિંગ હુકુમસિંઘજી રાજ્યુરોહીત (દેવાદાર), જ્થશ્રીકુવર રીડમાલસિંગ રાજ્યુરોહીત (સહ–દેવાદાર)	૧૭-૦૫-૨૩ રૂા. ૧૭,૧૯,૮૧૭/– (રૂપિયા સત્તર લાખ ઓગણીસ હજાર આઠસો સત્તર પુરા) ૧૫-૦૫-૨૩ મુજબ	હાઉસ નં. ૧૭૪, ગુગાદીપતી, ઉમિયા સંકુલ પાસે, નવો રેવન્યુ સર્વે નં. ૨૯૪, પાટણ, ગુજરાત ૩૯૪૧૫૧ ખાતેની રેસીડેન્સીચલ / કોર્મસીચલ જમીન / બિલ્ડીંગ/સ્ટ્રક્ચર અને ફીક્ચર્સના તમામ ભાગ અને હિસ્સા. ન્નેત્રફળ ૯૯ ચો.મી, પુર્વ: પાસેનું ઘર, પશ્ચિમ: અંદરનો રોડ, ઉત્તર: પાસેનું ઘર ૧૭૩, દક્ષિણ: અંદરનો રોડ.	૧૫–૦૫–૨૪
(A/cNo.) L9001060121495765, પટેલ અલ્પેશકુમાર મહેન્દ્રભાઈ (દેવાદાર) શ્રીમતી પટેલ મેહાબેન અલ્પેશભાઈ (સહ– દેવાદાર)	૧૩–૦૭–૨૩ ગ્ર.૪,૭૩,૭૦૧/– (રૂપિયા ચાર લાખ તોતેર હજાર સાતસો એક પુરા) ૧૨–૦૭–૨૩ મુજબ	મિલકત નં.૮૭, મોજે ગામ રાસ્કા, પેટા જિદ્યો મહેમદાબાદ, અને જિહ્યો ખેડા ખાતેની રેસીડેન્સીયલ/ કોર્મસીયલ જમીન/ બિલ્ડીંગ/સ્ટ્રક્ચર અને ફીક્ચર્સના તમામ ભાગ અને હિસ્સા. ગ્નેત્રફળ ૯૦૦ ચો.ફુટ, પુર્વ: જાહેર રોડ, પશ્ચિમ: કનુભાઇ ડાહ્યાભાઇનું ઘર, ઉત્તર: મહેશભાઇ રમણભાઇ પટેલનું ઘર, દક્ષિણ: કિરિટભાઇ રમણભાઇનું ઘર.	૧૫–૦૫–૨૪
(A/cNo.) L9001060117379926, પંકજકુમાર શંકરભાઈ પ્રજાપતિ (દેવાદાર), શ્રીમતી પ્રજાપતિ જાગૃતિએન પંકજભાઈ (સહ– દેવાદાર) શંકરભાઈ ભિખાભાઈ પ્રજાપતિ (સહ– દેવાદાર), મંગુએન પ્રજાપતિ (સહ–દેવાદાર)	૦૯–૧૦–૨૩ ગ્ર.૪,૨૨,૧૨૬/– (રૂપિયા ચાર લાખ બાવીસ હજાર એક્સો છવ્વીસ પુરા) ૦૭–૧૦–૨૩ મુજબ	મિલકત નં. ૦૬, ગામ ગાંગડિયા, વાણીયવાડા ગોરાડા ગૃપ, તાલુકો લુનાવાડા, જિલો મહીસાગર, ગુજરાત ખાતેની રેસીડેન્સીયલ / કોર્મસીયલ જમીન / બિલ્ડીંગ/સ્ટ્રક્ચર અને ફીક્ચર્સના તમામ ભાગ અને હિસ્સા. ન્નેત્રફળ ૧૨૦.૮૨ ચો.મી .	૧૫–૦૫–૨૪
(A/cNo.) L9001060124232330, પ્રકાશ એજન્સી (દેવાદાર), ખિમાણી પ્રકાશ કુમાર બાબુલાલ (સ૯–દેવાદાર), શ્રીમતી ખિમાણી કવિતાબેન પ્રકાશકુમાર (સ૯–દેવાદાર)	૧૩–૧૦–૨૩ ગ્ર. ૨,૬૦,૭૭૩/– (ગ્રુપિયા બે લાખ સાહીઠ હજાર સાતસો તોત્તેટ પુટા) ૧૦–૧૦–૨૩ મુજબ	ગામતલ મિલકત રજીસ્ટર્ડ રેવન્યુ સર્વે નં. ૧૧૦, મિલકત નં. ૪ ૧૩૯ ૧ મોજેગામ સાલિયા, સાંગ્રોડ, તાલુકો મોરવા, હડાક પંચમહાલ મોરવા, ગુજરાત ખાતેની રેસીડેન્સીયલ / કોર્મસીયાલ જમીન / બિલ્ડીંગ/સ્ટ્રક્ચર અને ફીક્ચર્સના તમામ ભાગ અને હિસ્સા. સેત્રફળ ૩૧.૪૭ ચો.ચાર્ડ .	૧૫–૦૫–૨૪

દેવાદારો રકમની ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા છે, પરિણામે દેવાદારો અને જાહેર જનતાને અહીં નોટીસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારે ઉપરોક્ત કોષ્ટકમાં જ્યાવેલ તારીખોનાં રોજ જ્યાવેલ નિયમ ૮ ના જ્યાવેલ (કાયદા) ની કલમ ૧૩(૪) સાથે વાંચન હેઠળ તે/તેણીને મળેલી સત્તાની રૂએ ઉપરોક્ત કોષ્ટકમાં જ્યાવેલ મિલક્તનો કબજો લઇ

"સિક્યોર્ડ એસેટને પરત મેળવવા માટે ઉપલબ્ધ સમય અંગે કાયદાની કલમ ૧૩ ની પેટા કલમ (૮) ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે." ખાસ કરીને દેવાદારો અને જાહેર જનતાને અહીં મિલકત સાથે કોઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનાં કોઇપણ સોદા **એયુ સ્મોલ ફાયનાન્સ બેંક**

લીમીટેડ (શિડ્યુલ્ડ કોમર્સિયલ બેંક) નાં ઉપરનાં કોષ્ટકમાં જણાવેલ ૨૬મ અને તેના પરના વ્યાજના ચાર્જને આધિન રહેશે. તારીખ : ૧૭/૦૫/૨૦૨૪ સ્થળ : અમદાવાદ સહી/– અધિકૃત અધિકારી એચુ સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડ

ગુજકેમ ડિસ્ટીલર્સ ઇન્ડિયા લીમીટેડ CIN: L74110GJ1939PCL002480

રજીસ્ટર્ડ ઓફીસ: સર્વે નં. ૧૪૬ , પ્લોટ નં. ૩૧૪, ૩૦૭ , ગીજો માળ આર્શિવાદ પારસ-૧, એસ.જી. હાઇવે, મક્ર્ટળા, અમદાવાદ-૩૮૦૦૫૧, ગુજરાત. h1997@gmail.com|વેબસાઇટ:guj

અસાદ્યારણ સામાન્ય સભાની નોટીસ અને રીમોટી ઈ-વોટીંગ આથી નોટીસ આપવામાં આવે છે કે ગુજકેમ ડિસ્ટીલર્સ ઇન્ડિયા લીમીટેડ (કંપની)ના સભ્યોન અસાધારણ સામાન્ય સભા (ઈજીએમ) શનિવાર, ૦૮ જુન, ૨૦૨૪ ના રોજ બપોરે ૧૨.૦૦ વાગ્યે કંપનીની રજસ્ટર્ડ ઓફીસ સર્વે નં. ૧૪૬, પ્લોટ નં. ૩૧૪, ૩૦૭, ત્રીજો માળ, આર્શિવાદ પારસ-૧ એસ.જી. હાઈવે, મકરબા, અમદાવાદ–૩૮૦૦૫૧, ગુજરાત ખાતે ઈજીએમ નોટીસમાં જણાવેલ કાર્યો પાર પાડવા નીચેના ઠરાવો માટે કંપનીના શેરહોલ્ડરોની મંજુરી લેવા માટે યોજાશે:-

ક્રમનં ઈજીએમમાં શેરહોલ્ડરોની મંજુરી માંગતા હરાવો

૧ પ્રેક્ટન્સીયલ ધોરણે કમ્પલસરી કન્વર્ટીબલ ડીબેન્ચર્સ (સીસીડીએસ) જારી કરવા

૨ પ્રેફ્ટન્સીયલ ધોરણે કન્વર્ટીબલ વોરંટો જારી કરવ

3 કપનીના મેમોરેન્ડમ ઓક એસોસિવેશનની મેઈન ઓબ્લેક્ટ ક્લોઝમાં કેરબદલી સદરહુ એમસીએ પરિપત્રો અને સિક્ચોરીટીઝ અને એક્સરોન્જ બોર્ડ ઓક ઇન્ડિયા (સેબી સરક્યુલર નં. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 તારીખ ૦૫ જાન્યુઆરી, ૨૦૨૩ના અનુપાલન હેઠળ, ઇજીએમની નોટીસ સભ્યો જેમના ઇમેઇલ એડ્સો કંપની/ડિપોઝીટરી પાટીશીપન્ટોમાં રજીસ્ટર્ડ છે તેમને ઇલેક્ટ્રોનિક પુદ્ધતિ મારફત મોકલવામા આવ્યા છે, સિવાચ કે સભ્યએ તેના ફીઝોકલ નકલ માટે અરજી કરેલ હોય. નોટીસ સ્ટોક એક્સચેન્જએટલે કે બીએસક લીમીટેડની વેબસાઈટ www.bseindia.com ઉપરથી પણ મેળવી શકાશે. જે સભ્યોએ તેમના ઈમેઈલ એડ્રેસો રજીસ્ટર્ડ કરાવેલ નથી તેઓ કંપનીને gujchemdistillers@gmail.com ઉપર લખી શકે છે. સિક્ચોરીટીઝ અને એક્સર્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્વાયરમેન્ટ્સ) નિયમનો, ર૦૧૫ ના નિયમન ૪૬ અન્વર્ય અને એમસીએ પરિપત્રો અનુસાર, અસાધારણ સામાન્ય સભા (ઇજીએમ) બોલાવતી નોટીસ કપનીની વેબસાઈટ www.gujchemdistillers.in પર અપલોડ કરાઈ છે. નોટીસ સ્ટોફ એક્સચેન્જ એટલે કે બીએસઈ

લાનાદુકના વખસાઇટ www.bselillia.com ઉપરથા વખાવા શકાશ. ઇંજીએમની નોટીસ ગુરુવાર, ૧૬ મે, ૨૦૨૪ના રોજ તમામ સભ્યોને ઇમેઈલ મારફત મોકલેલ છે. રીમોટ ઇં–વોટીંગનો સમયગાળો કંપનીના શેરહેલ્ડરો માટે બુધવાર, ૦૫ જુન, ૨૦૨૪ના રોજ સાંદો c.oo વાગ્યે શરૂ થશે અને શુક્રવાર, ૦૭ જુન, ૨૦૨૪ ના રોજ સોજેપ.૦૦ વાગ્યે પૂર્ણ ઘશે. આ સમયગાળા દરમિયાન કટ–ઓફ તારીખ ૦૧ જુન, ૨૦૨૪ ના રોજ ફીઝોકલ સ્વારૂપે અથવા ડીમેટીરીયલાઈઝડ સ્વરૂપે શેરહેલ્ડીંગ ધરાવતા કંપનીના શેરહેલ્ડરો ઇલેક્ટ્રોનિકલી તેમના મત

લીમીટેડની વેબસાઈટ www.bseindia.com ઉપરથી પણ મેળવી શકાશે.

આપી શકે છે. ઉપર જણાવેલ તારીખ અને સમય પછી ઈ-વોટીંગ મોડ્યુલ સીડીએસએલ દ્વારા બંધ કરવામાં આવશે અને સભ્યએ ક્સાવ પર એક વખત મત આપ્યા પછી, સભ્યને ફરીથી તે બદલવાની પરવાનગી મળશે નહી. બેલોટ પેપર મારફત મતદાનની સવલત પણ સભામાં ઉપલબ્ધ રહેશે અને સભામાં હાજ્ટ રહેનાર સભ્યો જેમણે રીમોટ ઈ-વોટીંગ થી તેમના મત ઝાપેલ નથી તેઓ સભામાં તેમના હકનો ઉપયોગ કરી શકશે. સભ્યો જેમણે સભા પહેલારીમોટ ઇ-વોટીંગ થી તેમના મત આપેલ છે, તેઓ સભામાં પણ હાજર રહી શકે છે પરંતુ ફરીથી તેમના મત આપવા હકદાર ગણાશે નહી કટ-ઓફ તારીપના રોજ જે સભ્યનું નામ રજીસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ઉપોઝીટીરીઓ દ્વારા સંચાલિતલાભાર્થિ માલિકોના રજીસ્ટરમાં નોંધાયેલ છે ફક્તતેજરીમોટ ઇ-વોટીંગતેમજબેલોટ પેપેર મારકૂત ઈજીએમમાં વોટીંગની સવલત મેળવવા હકદાર ગણાશે. ઈજીએમની નોટીસ મોકલ્યા પછી કંપનીના શેરો પ્રાપ્ત કરનાર અને કંપનીની સભ્ય બનનાર અને શેર હોલ્ડીંગ ધરાવતી કોઈપણ વ્યક્તિ helpdesk.evoting@cdslindia.com પર અરજી મોકલીને લોગીન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે.

કોર્પોરેટ અફર્સ મંત્રાલયના જનરલ સરક્યુલર નં. ૧૭/૨૦૨૦ તારીખ ૧૩ એપ્રિલ, ૨૦૨૦ અનુસાર ઈજીએમની નોટીસ કંપનીની વેબસાઈટ www.gujchemdistillers.in પર અપલોડ કરાઈ છે. નોટીસ સ્ટોક એક્સચેન્જએટલે કે બીએસઈ લીમીટેડની વેબસાઈટ www.bseindia.comઉપરથી પણ મેળવી શકાશે. ઈજીએમની નોટીસ સીડીએસએલ (રીમોટ ઈ-વોટીંગ સવલત પુરી પાડનાન એજન્સી) ની વેબસાઈટ www.evotinindia.com ઉપર પણ પ્રસારિત કરવામાં આવેલ છે. ઈ-વોટીંગ સંબંધિત કોઈપણપુછ્પરછ અથવા સમસ્યા માટે, તમે હેલ્પ સેક્શન હેઠળ – ઉપર ઉપલબ્ધ ફીકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્વન્સ (એફએક્યુએસ) અને ઈ-વોટીંગ મેન્યુઅલ જોઈ શકો છો અથવા helpdesk.evoting@cdslindia.com ને ઈમેઈલ લખી શકો છો અથવા ૦૨૨ ૨૩૦૫૮૫૪૨/૪૩ને કોલ કરી શકો છો.

ઇલેક્ટ્રીનિક માધ્યમી દ્વારા મતદાની સવલત સાથે સંકળાયેલ તમામ કરિયાદો શ્રી રાકેશ દલ્વી મેનેજર, સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝ(ઇન્ડિયા)લીમીટેડ, એ વિંગ, રૂપ મો માળ, મેરેથોન ક્યુચરેક્સ મફતલાલ મિલ કમ્પાઉન્ડ્સ, એનએમ જોષી માર્ગ, લોઅર પારેલ (ઇસ્ટ), મુંબઇ-મહારાષ્ટ્રને જણાવી શકાશે અથવા helpdesk.evoting@cdslindia.com ને ઈમેઈલ કરવો અથવા ૨૩૦૫૮૫૪૨/૪૩ને કોલ કરવો

માંગણા

બોર્ડ ઓફ્ડાયરેક્ટર્સના આદેશથી **ગુજકેમ ડિસ્ટીલર્સ ઇન્ડિયા લીમીટેડ** માટે સહી/-શ્રી સાગર સમિર શાહ

> ચેરમેન અને ડાયરેક્ટર DIN: 03082857

તારીખ: ૧૭.૦૫.૨૦૨૪ સ્થાળ: અમદાવાદ

રીલાયન્સ કોર્મસીયલ ફાયનાન્સ લીમીટેડ AUTHUM

नोहीस

રજીસ્ટર્ક ઓફીસ : ધ રૂગી , અગિયારમો માળ , નોર્થ ઇસ્ટ વિંગ, પ્લોટ નં. ૨૯, રોનાપતી બાપટ માર્ગ, દાદર (વેસ્ટ), મુંબઇ-૪૦૦ ૦૨૮, ફ્રોના : +૯૧ ૨૨ દ્ ૮૩૮ ૮૧૦૦/ ફેક્સ : +૯૧ ૨૨ દ્ ૮૩૮ ૮૩૬૦, ઇમેઇલ : rd.secretarial@relian.ces વેબસાઇટ : www.reliancemoney.co.in, કરસ્મર સર્વિસ : ફ્રોન : +૯૧ ૨૨ ૪૭૪૧ ૫૮૦૦ / ઇમેઇલ : customercare@ oney.co.in, ระลหว ะเดีย : ร)ๆ : +eq २२ ชอชุๆ นะ๑๐ / ยุหยด : customercare@reliance જ્યાવાનું કે નીચે જ્યાવેલ દેવાદારો/સહ–દેવાદારો/જામીનદારો/ગીરવેદારોએ રીલાયન્સ કોર્મસીચલ ફાયનાન્સ લીમીટેડ પાસેસથી નાણાંકિય સવલતો લીધી હતી. અમે જ્ણાવીએ છીએ કે નાણાંકિય સવલતો લીધી હોવા છતાં, દેવાદારો/જામીનદારો ગીરવેદારોએ નિયત તારીખો મુજબ મુદ્દ રકમો અને વ્યાવની પરતચુકવણીમાં વિવિધ કસુરો કર્યા છે. એકાઉન્ટો નેશનલ હાઉસિંગ બેંક દ્વારા જારી કરાયેલ મિલકત વર્ગીકરણના સંબંધમાં ાદેશો મુજબ આરસીએફએલની બુકમાં નીચે જણાવેલ જેતે તારીખોએ નીન પરફ્રીમિંગ એસેટ તરીકે વગીકૃત કરાયા છે, પરિણામે રીલાયન કોર્મસીયલ કાયનાન્સ લીમીટેડના અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇઝેસન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અન એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૩ સાથે વચાતી કલમ ૧૩(૧૨) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને સરફૈસી એક્ટની કલમ ૧૩(૨) હેઠળ નીચે જ્યાવેલ જેતે તારીખોએ માંગણા નોટીસો જારી કરી નીચે જણાવેલ દેવાદારો/જામીનદારો/ગીરવેદારોને નોટીસમાં જણાવેલ રકમ તેમજ નોટીસમાં જણાવેલ રકમ પર કરારના દરે ચડત વ્યાજ અને

ર્તેમને તેના છેલા જાશીતા સરનામાં પર જારી કરાયેલ નોટીસો બજવણી વગર પરત ફરી હોવાથી તેઓને આ જાહેર નોટીસના માર્ગે જાણ કરવામાં આવી રહી છે.

ચુકવણીની તારીખ સુધી આકરિમક ખર્ચ, કોસ્ટ, ચાર્જિસ વગેરે નોટીસો મળ્યાની તારીખલી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવે છે.

ક્રમ નં.		સહ-દેવાદારઅને જામીનદારનું નામ ડાય રેક્ટ રનું નામ	એનપીએ તારીખ	માંગણા નોઢીસની તારીખ	ફુલ બાકી કુલ બાકી	લોનની રક્મ
1.	RLELRAJ000453551 અશોક કુમાર દિવેશચંદ્ર, કાંગર, રેવન્યુ સર્વે નં. ૨૨૭/ફ અને ૨૨૭/૦, (મવડી), ફલેટ નં. બી–૮૦૧, આક્યો માળ, રસ્તુરી અવિર, અંબિડા ટાઉનશિય, રસ્તુરી રેસિડેન્સી પાછળ, રાજકોટ-૩૬,૦૦૦૫, અ લી પણ : સરદારનગર રોડ નં. 3, રાજમંદિર કુડ રોડ, ટાગોર રોડ સામે, રાજકોટ-૩૬,૦૦૦૨, અલી પણ: રેવન્યુ સર્વે નં. ૨૨૭/૬ અને ૨૨૭/૦, (મવડી), ફલેટ નં. બી–૮૦૧, આઠમો માળ, કસ્તુરી અવિર, અંબિડા ટાઉનશિય, કસ્તુર રેસિડેન્સી પાછળ, રાજકોટ-૩૬૦૦૦૫.	એન્ટરપ્રાદઝ	સ્પ.૦૮ .૨૦૧૯	8905.E0.05	ગ્ન. ૫૭,૩૮,૧૭૮/– (રૂપિયા સત્તાવન લાખ આડગીસ હન્મર એક્સો ઇઠ્યોતેર પુરા)	રૂા. ૨૫,૦૦,૦૦૦/– (રૂપિયા પચ્ચીસ લાખ પુરા)
					0 0 :	0 0

ı	2.	RLLPRAJ000330846	સાજીયાબાનુ	06.45.5046	£9.03.2028	રૂા. ૨૩,૬૦,૭૪૫/-	ąı.
ı		અવેશ જબ્બરભાઇ કુરેશી , મારુતી ન ગર,એરપોર્ટ રોડ , રોડ	અલેશભાઇ કુરે શી			(રૂપિયા ગ્રેવીસ લાખ	€,00,000
ı		નં. ૨, રાજકોટ-૩૬૦૦૦૧, અહીં પણ : મેક આર્ટ ઇન્ટીમેશન,				સાહીઠ હજાર	(લપિયાન લ
ı		ઓફીસ નં. ૨૧૧, બીજો માળ, પારુલ કો મ્પલેક્ષ બી, સરદા ર				સાતસો પીસ્તાલીસ	લાખ પુરા)
ı		સ્કૂલ સામે, સેન્ટ કબિર રોડ, કૂવાડવા રોડ, રાજકોટ-					લાબ પુરા,
ı		3૬૦૦૦૩, અહીં પ ણ : ઓફીસ નં. ૨૧૧, બીજો માળ, પારુલ				પુરા)	
ı	l	કોમ્પલેટ્સ બી, સરદાર સ્કૂલ સામે, સંત કબિર રોડ, કૂવાડવા					
ı		2) 5 115 14 2105 12 25 25 25 2		l			

સિક્ચોર્ક મિલક્તની વિગત : જમીનનું ક્ષેત્રફળ રેવન્યુ સર્વે નં. સર*ાં*દ્દ, સરક/૭ (મલકી) ટી. ફ્લેટ નં. બી–૮૦૧, નવમો માળ, કરતુરી અવિરય, અંબિકા ટાઉનક્ષિપ કરતુરી રેસિર્ડન્સી, મુવડી, સજ્કોટ–૩૬૦૦૦૫ ખાતેની મિલકતના તમામ ભાગ અને હિરસા .પુર્વ : ફ્લેટ નં. બી–૮૦૨, પશ્ચિમ : માર્જીન **૧૦**ચા, ઉત્તર : માર્જીન **૧૦**ચા કસ્તુરી રેસિડેન્સી, મવડી, રાજકોટ-૩૬૦૦૦૫ ખાતેની મિલકતના તમા દક્ષિણ : ફ્લેટ નં. બી–૮૦૪ કબિર રોડ (૨૫.૦૦ મીટરનો પહોળો રોડ)

3.	RLLSRAJ000344185 & RLLSRAJ000344201	મીરા શિતલ મેહતા /	02.09.2020	२८. ०३.२०२४	ąı.	ąı.
	ગેરન્ટી નુએવો પેપર્સ પ્રાઇવેટ લીમીટેક – ફ્લેટ નં. ૩૦૨,		l		2,03,29,220.00	9,38,00,000
	ત્રીજો માળ,ર્તિથ એપાર્ટમેન્ટ,જગ નાથ પ્લોટ,શેરી નં. ૬/૧૧,		l		(રૂપિયા બે કરોડ	
	રાજકોટ–૩૬૦૦૦૧, મોબાઇલ નં. : ૯૮૨૫૨૧૫૫૪૪, અહીં		l		''	
	પણ : ગાર્મેન્ટ નુઇવો પેપર્સ પ્રાઇવેટ લીમીટેડ, પાંચમો માળ,		l		તોત્તેર હજાર	(રૂપિયા એક
	૫૦૧/૫૦૨/૫૦૩, રતનરાજ સ્ત્રીંગ, એચડીએફ્સી બેંક		l		એક્યાસી હજાર	કરોડ છત્રીસ
	મીઠાખળી સામે, અમદાવાદ–૩૮૦૦૦૯ અહીં પણ : ફ્લેટ નં .		l		બરસો સીત્યાસી	લાખ પરા)
l	૩૦૨, ત્રીજો માળ, તિર્થ એપાર્ટમેન્ટ , જગનાથ પ્લોટ , શેરી નં .		l			
	६/११,२।४९)८–३६०००१				પુરા)	

સિક્યોર્ડ મિલકતની વિગતઃ ક્લેટ નં. ૩૦૨, ત્રીજો માળ, તિથં એપાર્ટમેન્ટ, સિટી સર્વે વોર્ડ નં. ૧૪ સિટી સર્વે નં. ૩૦૧, પશ્ચિમ : અન્ય જિલ્લા જિલ્લા

146	મલકત.						
4.	RLLPRAJ000202756.	દિનેશભાદ	०૯.९०.२०९६	8505.80.05	રૂા. ૩૧,૪૧,૩૩૧/-	ąı.	
	મુ કે શભાઇ વિકુલભાઇ ધામેચા, ફ્ લેટ નં. એફ/૭૭, બ્લોક નં.	વિકુલભાઇ ધામેથા /			(રૂપિયા એક્ત્રીસ	6,92,000/-	
	૪, આશિષ કોમ્પલેક્ષ, આનંદ નગર કોલોની, કોઠારિયા	કેલાશ ે ન			લાખ એકતાલીસ	(રૂપિયા નવ	
	ીરોડ. રાજકોટ-3E000ર. સાહી પણ : મીના. માસ્તર ી				હજાર ત્રણસો	લાખ અઢાર	
					એક્ત્રીસ પુરા)	હજાર પુરા)	
	આશિષ કોમ્પલેક્ષ, આનંદ નગર કોલોની, કોહસિયા રોડ,	વિકુલભાઇ ધામેથા /					
	राक्ष्येऽ-3६०००२	પરેશભાજ					
		વિકુલભાઇ ધામેથા /					
		વિકલભાઇ શકુભાઇ					
		દ્યામેથા / વિકુલભાઇ					
		વકુભાઇ ધામેથા					
સિક	સિક્સોર્ડ મિલકતની વિગત: ૧મીનનું ક્ષેત્રફળ ફ્લેટ નં.એફ/૭૭, બ્લોક નં. ૪, આશ્રિષ કોમ્પલેકા, આનંદનગુર કોલોની, કોઠારિયા રોડ, રાજકોટ–૩૬૦૦૦૨ ખાતેની						

સ્તરવાર મામ્યુક્ત મામવાલ . પ્રયાનનુ દ્વાત્રકળ ફ્લટ ન .અક/૭૭,બ્લાક ન. ૪,આશિષ કોમ્પલેક્ષ, આનંદન ગર કોલોની, કોઠારિયા રોડ, રાજકોટ–૩૬૦૦૦૨ ખાતેને મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુસીમા : ઉત્તર : ફ્લેટ નં. એફ–૮૦, દક્ષિણ : ફ્લેટ નં. એફ–૮૦, દક્ષિણ : રોડ, પુર્વ : ફ્લેટ નં. એફ–૭૬, પશ્ચિમ : ફ્લેટનં એફ–૭૮

ઉપરોક્ત સંજેગોવસાત, આથી ઉપરોક્ત દેવાદારો, સહ–દેવાદારો અને/અથવા તેમના જામીનદારો (જ્યાં લાગુ પડતાં હોય ત્યાં) ને ઉપર જ્યાવેલ ગાકી રકમ તેમજ ચડત વ્યાજ અને લાગુ ચાર્જિસ આ નોટીસ પ્રસિદ્ધ થયાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવામાં આવે છે, જેમાં નિષ્ફળ જતાં આ નોટીસની તારીખના ૬૦ દિવસ પુરા થયેલ સિક્યોર્ડ મિલકતો સામે સિક્યોરીટાંછ)શન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાર્ન્સિયલ એસેટ્સ્ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અને તે હેઠળ લાગુ નિચમો હેઠળ દેવાદારો અને ગીરેદારોની સિક્ચોર્ડ મિલક્તોનો કબજો લેવા સહીત અન્ય પગલા લેવામાં આવશે

નોંધ લેવી કે જણાવેલ એક્ટની કલમ ૧૩(૧૩) હેઠળ, દેવાદાર સિકચોર્ડ લેણદારની આગોતરી લેખીત મંજુરી વગર, નોટીસમાં જણાવેલ સિક્ચોર્ડ મિલકતોમાંથી કોઇપણનું વેચાણ, ભાડે અથવા અન્ય રીતે ફેરબદલી કરી શકશે નહી.

સ્થળ: રાજકોટ

અધિકૃત અધિકારી રીલાયન્સ કોર્મસીયલ ફાયનાન્સ લીમીટેડ

l look at every side before taking a side.

nform your opinion with insightful observations



For the Indian Intelligent,